



Market News

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25200 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82,442 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,268.35 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,637.03 સુધી પહોંચ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68 ટકા વધીને 59,286.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા વધારાની સાથે 19,307.10 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 308.01 અંક એટલે કે 0.38% ની મજબૂતીની સાથે 82,442.62 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 83.90 અંક એટલે કે 0.33% ની વધારાની સાથે 25,235.90 ના સ્તર પર બંધ થયા છે.

ઈન્ફાસ્ટ્રક્ચર અને કંસ્ટ્રક્શન સર્વિસિઝ કંપની પટેલ ઈજીનિયરિંગના શેરમાં 30 ઓગસ્ટના સારી ખરીદારી થઈ અને શરેની કિંમત 7 ટકા સુધી વધી. કંપનીએ એક દિવસ પહેલા શેર બજારોને જણાવ્યું કે તેને નવરત્ન CPSE રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ની સાથે એક MoU સાઈન કર્યા છે. આ સમજોતા ભારત અને વિદેશમાં હાઈડ્રો અને અન્ય ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કોલેબોરેશન માટે છે.

આ અપડેટની બાદ પટેલ ઈજીનિયરિંગના શેર બીએસઈ પર સવારે વધારાની સાથે 54.76 રૂપિયા પર ખુલ્યા. ત્યારબાદ તેમાં

છેલ્લા બંધ ભાવથી 7 ટકા વધ્યો અને 57.39 રૂપિયાના હાઈ હિટ થયો. બીએસઈ પર શેરના 52 સમાહના ઉચ્ચ સ્તર 79 રૂપિયા અને નિચલા સ્તર 41.99 રૂપિયા છે.

પટેલ ઈજીનિયરિંગે એક્સપેંજ ફાઈલિંગમાં કહ્યું કે MoU એક એવા સહયોગાત્મક ફેક્ટવર્કની રૂપરેખા તૈયાર કરે છે, જે હાઈડ્રો અને અન્ય ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને શરૂ કરવા માટે બંને કંપનીઓની તાકાત અને વિશેષજ્ઞતાને એક સાથે લાવશે. આ સમજોતો બંને કંપનીઓની વિભિન્ન ક્ષમતાઓમાં સહયોગની તકોને શોધવામાં સક્ષમ બનશે.

Honasa Consumer Share Prices: મામાઅર્થ (Mamaearth), ધ સર્મા (The Derma) અને બીબ્લંટ (BBlunt) ની પેરેન્ટ કંપની હોનાસા કંઝ્યુમરના શેરોમાં આજે ખરીદારીનું વલણ દેખાયું. તેને આ કંપનીના મર્જર માટે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મંજૂરી મળી ગઈ છે જેને શેરોને લઈને માહોલ પોઝિટિવ કરી દીધો. તેના ચાલતા શેર 14 ટકાથી વધારે ઉછળીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા. હાલમાં BSE પર આ 10.44 ટકાના વધારાની સાથે 518.20 રૂપિયાના ભાવ પર છે. ઈટ્રા-ડે માં આ 14.63 ટકા ઉછળીને 537.85 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

Results & Corporate Action




Corporate Action	Company	Type & Percentage	Record Date	Ex-Date
Splits	<u>Bondada Eng.</u>	Old FV 10 New FV 2	02-09-2024	02-09-2024
Splits	<u>Sapphire Foods</u>	Old FV 10 New FV 2	05-09-2024	05-09-2024
Rights	<u>Patel Integrate</u>	Rights Ratio 8:103	06-09-24	06-09-24
Dividend	<u>Vinati Organics</u>	Final 700.00	03-09-2024	03-09-2024
Dividend	<u>Ion Exchange</u>	Interim 150.00	03-09-2024	03-09-2024
Dividend	<u>Uni Abex</u>	Final 250.00	04-09-2024	04-09-2024
Dividend	<u>RHI Magnesita</u>	Final 250.00	05-09-2024	05-09-2024
Dividend	<u>Gulf Oil Lubric</u>	Final 1000.00	05-09-2024	05-09-2024
Dividend	<u>Triveni Turbine</u>	Final 130.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Triveni Engg</u>	Final 125.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Guj Intrux</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Sterling Tools</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Sika Interplant</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Protean eGov</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Zen Tech</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>KRBL</u>	Final 400.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Jagsonpal Pharma</u>	Final 100.00	06-09-2024	06-09-2024




Corporate Action	Company	Type & Percentage	Record Date	Ex-Date
Dividend	<u>Uniphos Ent</u>	Final 285.00	06-09-2024	06-09-2024
Dividend	<u>GNFC</u>	Final 165.00	06-09-2024	06-09-2024
Dividend	<u>Triton Valves</u>	Final 100.00	06-09-2024	06-09-2024
Dividend	<u>SML Isuzu</u>	Final 160.00	06-09-2024	06-09-2024

Nifty Spot in Last Week:-

ઉપરમાં ૨૫૩૯૯.૦૦ અને નીચામાં ૨૪૮૩૫.૦૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Fut in Upcoming Week:-

NIFTY ઉપરમાં ૨૫૫૦૦ થી ૨૫૭૦૦ નું resistance છે નીચામાં ૨૪૮૫૦ નો strong support છે.

Bank Nifty Fut in Upcoming week:-

BANK NIFTY નીચામાં ૫૧૦૦૦ નો strong support છે ઉપરમાં ૫૨૦૦૦ થી ૫૨૫૦૦ સુધી નો ભાવ આવી શકે.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above/Below/ Add HOLD	CMP as on 31.08.2024	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	NILAINFRA(BUY)	ABOVE 15.40	14.40		14.00		20
2	VIJYA(BUY)	HOLD 832	932	885			975
3	TTML(BUY)	HOLD 89	97		80		115-150

Commodity Market

COPPER CMP(806):- ઘટાડે ૭૭૦ થી ૭૭૫ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૭૪૦ નો sI રાખવો ઉપરમાં ૮૫૦ સુધી નો ભાવ આવી શકે.



CRUDEOIL CMP(6201):- ઘટાડે ૫૫૦૦ થી ૫૬૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૨૫૦ નો sI રાખવો ઉપરમાં ૭૩૦૦ સુધી નો ભાવ આવી શકે.

SILVER CMP(85248):- ઘટાડે ૮૧૭૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૭૯૭૦૦ નો sI રાખવો ઉપરમાં ૮૮૦૦૦ સુધી નો ભાવ આવી શકે.



GOLD CMP(71651):- ઘટાડે ૬૬૩૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૬૫૧૦૦ નો sI રાખવો ઉપરમાં ૬૯૦૦૦ સુધી નો ભાવ આવી શકે, ઉછાળે ૭૨૫૦૦ ની રેન્જમાં વેચાણ કરી શકાય ૭૩૨૦૦ નો sI રાખવો નીચામાં ૬૬૫૦૦ સુધી નો ભાવ આવી શકે.

બેંક થાપણોની અસંખ્ય વાર્તા.

લેખક: સૌમ્ય કાંતિ ઘોષ

સ્ત્રોત: બિઝનેસ સ્ટાન્ડર્ડ (https://www.business-standard.com/opinion/columns/the-untold-story-of-bank-deposits-124081901082_1.html)

આ એક રસપ્રદ લેખ છે જે બેંકોની થાપણો શા માટે ઘટી રહી છે તેનો સૌથી ખાતરીપૂર્વકનો જવાબ લાગે છે.

અમે આ લેખ M/e Marcellus Investments Manager vis ના સમાચાર પત્રમાંથી લીધો છે. 'થ્રી લોંગ્સ એન્ડ થ્રી શોર્ટ્સ

ભારતીય ઇક્વિટી બજારોમાં આગ લાગી છે ત્યારે, કોઈપણ દેખીતી નિરાશાઓ પર પરસેવો છૂટી રહ્યો નથી, પછી તે ચૂંટણી પરિણામો હોય કે વેન કેરી ટ્રેડની

અનવાઈન્ડિંગ હોય કે ન તો એકદમ મ્યૂટ કમાણીની સિઝન પસાર થઈ હોય. તેમ છતાં ભારતીય બેંકિંગ શેરો થાપણની તંગી (થાપણો બેંક લોન માટે કાયો માલ છે) અંગેની ચિંતાઓથી પાછળ છે. બેંકના સીઈઓથી લઈને રોકાણકારો સુધીના દરેક વ્યક્તિએ આ સપ્તાહની શરૂઆતમાં ખરેખર નાણામંત્રી સુધી આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી છે. રોકિંગ નાણાકીય બજારની વચ્ચે દેખીતી રીતે સ્વસ્થ અર્થતંત્રમાં, બેંકો શા માટે થાપણો વધારવા માટે સંઘર્ષ કરશે? ખરેખર, આજુબાજુના વિવિધ ખુલાસાઓ વચ્ચે, તેમાંથી એક બજારની જ તેજી છે, એટલે કે, વ્યક્તિઓ અને કોર્પોરેટ બેંકોમાં તેમની થાપણો રાખવા કરતાં બજારમાં ભાગ લેવામાં ખુશ છે. નાયસેયર્સ દલીલ કરે છે કે તે આંશિક રીતે સમજાવે છે કે નિયમનકારી પ્રવાહિતાના પરિપ્રેક્ષ્યમાં થાપણોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, તે નાણાં બેંકિંગ સિસ્ટમમાં જ રહેવા જોઈએ.

દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અને 16મા નાણાપંચના સભ્ય સૌમ્ય કાંતિ ઘોષ તરફથી અહીં વધુ સૂક્ષ્મ સમજૂતી આપવામાં આવી છે.

તે સૌપ્રથમ એ હકીકત પર પ્રશ્ન કરે છે કે થાપણ વૃદ્ધિ ક્રેડિટ વૃદ્ધિ પાછળ રહી છે:

“...આંકડા સૂચવે છે કે રૂ. 61 ટ્રિલિયનના વધારાની થાપણ વૃદ્ધિએ નાણાકીય વર્ષ 22 થી રૂ. 59 ટ્રિલિયનની વૃદ્ધિની ધિરાણ વૃદ્ધિને પાછળ છોડી દીધી છે. આથી, થાપણ વૃદ્ધિ ખરેખર ધિરાણ વૃદ્ધિ કરતાં આગળ વધી ગઈ છે. આમ ખરેખર મહત્ત્વની બાબત એ છે કે 8 ટકાના દરે વિસ્તરી રહેલી અર્થવ્યવસ્થાની ધિરાણ જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે ડિપોઝિટ વૃદ્ધિનું આટલું પ્રમાણ પૂરતું છે કે કેમ અને તેને કયા ભાવે એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

પછી તે બચતની દલીલના નાણાકીયકરણને રદિયો આપે છે:

“...પરિવારો ખરેખર બચતના વૈકલ્પિક સાધનો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી અને નોન-બેંક ડિપોઝિટમાં રોકાણ કરે છે. આ સાધનોનો હિસ્સો રૂ. 3.2 ટ્રિલિયન અથવા FY23માં રૂ. 29.7 ટ્રિલિયનની વધારાની ધરગથ્થુ બચતના 10.5 ટકા છે. આ રૂ. 29.7 ટ્રિલિયન પાછ અથવા 42 ટકામાંથી પરિવારોએ હજુ પણ રૂ. 10 ટ્રિલિયન બેન્ક થાપણોમાં અને રૂ. 2.5 ટ્રિલિયન નાની બચત થાપણોમાં રોકાણ કર્યું છે. બાકીના પેન્શન અને પ્રોવિડન્ટ ફંડમાં ધરગથ્થુ રોકાણો સંબંધિત બજારના ખેલાડીઓ દ્વારા ચેનલ કરવામાં આવ્યા હતા.

ઘણા વિશ્લેષકો ભૂલથી વૈકલ્પિક સાધનોમાં આવી બચતને નાણાકીય સિસ્ટમમાંથી લીકેજ તરીકે માને છે અને તેથી બેંક થાપણોમાં ઘટાડાનું કારણ છે. જો કે આ ખોટું છે, કારણ કે બેન્કિંગ ડિપોઝિટનો ઉપયોગ વ્યવહારિક હેતુઓ માટે થાય છે જેના દ્વારા પરિવારો બચતના સાધનોમાં ફેરફાર કરે છે, જેમ કે બેન્ક ડિપોઝિટમાંથી મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇક્વિટી (નાની બચતમાં થાપણો સિવાય) અને તેથી તે નાણાકીય સિસ્ટમમાં રહે છે.

પછી ડિપોઝિટ કંચ શું સમજાવે છે? લેખકનું માનવું છે કે જ્યારે લીકેજ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જતા નાણાંમાંથી નથી, ત્યાં અન્ય લિકેજ છે:

“સિસ્ટમમાંથી ચાર લિકેજ છે. સરકારની રોકડ બેલેન્સ પાછના 10 ટકા છે. સરકાર કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ માટે ભંડોળના સમયસર વિતરણ તરફ આગળ વધી રહી છે જેમાં રાજ્યનો હિસ્સો મેળ ખાતો હોય છે, આવી વહેંચણી માટેની પ્રક્રિયાના પ્રવાહમાં ફેરફાર થયો છે.

અગાઉ, રાજ્યો દરેક યોજના માટે સિંગલ નોડલ એજન્સી (SNA) ને ઓળખતા હતા અને તે મુજબ બેંકોમાં ખાતા ખોલતા હતા. જો કે, નવી વ્યવસ્થામાં, આ ખાતાઓ હવે કેન્દ્ર દ્વારા આરબીઆઈ ખાતે ખોલવામાં આવે છે, ત્યારબાદ રાજ્યોની નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા બહાર પાડવામાં આવે છે. સરકારનું રોકડ સંતુલન, જે અગાઉ બેંક થાપણો દ્વારા સરકારી ખર્ચની આડપેદાશ હતું, હવે આરબીઆઈ તરફથી થઈ રહ્યું છે.

ત્યાર બાદ ડિપોઝિટ પર ટેક્સ પેમેન્ટ અને સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ દ્વારા લીકેજ થાય છે જે લીકેજના 8.7 ટકા છે. બેંક થાપણો સૌથી વધુ આવકના બકેટ્સ પર કરને આધીન છે અને જમા રકમ (મૂળ અને વ્યાજ) પર કર લાદવામાં આવે છે. આ અન્ય અસ્કયામત વર્ગોથી વિપરીત છે, જ્યાં કરની સારવાર અલગ હોય છે અને વસૂલાત માત્ર રિડેમ્પશન પર કરાય છે.

અન્ય બે લીકેજ નાની બચત છે (આ ફક્ત બેંકોમાં શેડો એકાઉન્ટ્સ છે) 7 ટકા અને ચલણ 5.3 ટકા છે. આમ, એકંદરે ધિરાણ પાછ 39 ટકા અથવા રૂ. 23.9 ટ્રિલિયન છે, જેમાંથી પ્રાધાન્યતા ક્ષેત્રની પ્રતિબદ્ધતાઓ 15 ટકા છે.”

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2. (Guj.) India Ph: 0261-40 60 750, 246 27 90 Fax: 0261-246 27 91 www.markethubonline.com E-Mail: info@markethubonline.com

IA SEBI REGISTRATION NO.:INA000005333

Disclaimer:

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information.

INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing